



## વડોદરા મહાનગરપાલિકા

[www.vmc.gov.in](http://www.vmc.gov.in)

આકારણી રજિસ્ટર પ્રસિધ્ધ કરવા બાબત

વડોદરા મહાનગર પાલિકા ના વહીવટી વોર્ડ નં. ૪, ૧૨ અને ૯ ના હદ વિસ્તારમાં આવેલી રહેણાંક સિવાયની અને ઔદ્યોગિક એકમો વાળી મિલકતના સને ૨૦૧૯-૨૦ના વર્ષના આકારણી રજિસ્ટર ધી ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-૧૯૪૯ના પરિશિષ્ટ 'ક' ના પ્રકરણ-૮ ના નિયમ ૯ તથા નિયમ ૧૩ થી ૧૬ મુજબની પ્રસિધ્ધી બાબતે જાહેર નોટીસ

ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ મુજબ વહીવટી વોર્ડ ૪, ૧૨ અને ૯ માં આવેલી રહેણાંક સિવાયની અને ઔદ્યોગિક એકમો વાળી મિલકતનો સામાન્ય કર આકારવા અંગેના વિવિધ પરિબળો તેમજ શિક્ષણ ઉપકર, પાણી કર, તથા કન્ઝર્વેન્સી અને સુઅરેઝ ટેક્ષ, ફાયર ટેક્ષ વિગેરેની વિગતો દર્શાવતા વહીવટી વોર્ડ નં. ૪, ૧૨ અને ૯ ના હદ વિસ્તારમાં આવેલી રહેણાંક સિવાયની અને ઔદ્યોગિક એકમો વાળી મિલકત મિલકતોના સને ૨૦૧૯-૨૦ ના વર્ષના આકારણી રજિસ્ટર આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ રજિસ્ટરમાં દાખલ કરેલી વિગતો અને નોંધો, કચેરી ના કામકાજના દિવસોમાં સવારના ૧૦.૩૦ થી ૧.૦૦ તથા ૧.૩૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી સંબંધિત વહીવટી વોર્ડની કચેરીમાં જોવા મળશે. આકારણી રજિસ્ટરમાં નોંધવામાં આવેલ વિગતો બાબતે જો કોઈ વાંધો હોય તો લેખિત વાંધા અરજી તા. ૨૫-૬-૧૯ સુધીમાં સાદા કાગળમાં સંબંધિત વહીવટી વોર્ડની કચેરીમાં આપી તેની પહોંચ મેળવી લેવી અથવા તમારી નકલ ઉપર સહી સિક્કા કરાવી લેવા.

અન્ય બાબત:- સદર જાહેરાત સંબંધી વધુ વિગતો તેમજ સમજ મેળવવા માટે સંબંધિત વહીવટી વોર્ડની કચેરીનો સંપર્ક કરવો.

પી.આર.ઓ. નં. ૧૪૭/૨૦૧૯-૨૦

મ્યુનિસિપલ કમિશનર